

ફેબ્રુઆરી 16, 2018

બ્રામ્પટન માટે એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સુપર-ક્લસ્ટર ઘોષણાથી ઉભરતી તકો

બ્રામ્પટન, ઓન્ટેરિયો – માનનીય નવદીપ બેઈન્સ (Navdeep Bains), કેનેડાના નવીન શોધ, વિજ્ઞાન અને આર્થિક વિકાસ માટેના મંત્રીએ ગઈકાલે જાહેરાત કરી કે કેનેડા માટે એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સુપર-ક્લસ્ટર, કેનેડા સરકારની ઈનોવેશન સુપર-ક્લસ્ટરની પહેલ હેઠળ સંઘીય રોકાણો (ફેડરલ ઈન્વેસ્ટમેન્ટ્સ) મેળવવાને લાયક બન્યું છે.

એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સુપર-ક્લસ્ટર બોલીમાં 140 ઉપરાંત સંસ્થાઓ સહભાગી થઈ. સીટી ઓફ બ્રામ્પટને બહુ વિશાળ સુપર-ક્લસ્ટર પ્રોજેક્ટમાં ભંડોળ માટે પ્રતિભાષાળી વિકાસ દરખાસ્ત અંગે બ્રામ્પટન બોર્ડ ઓફ ટ્રેડ સાથે ભાગીદારી કરી. આ દરખાસ્ત અને એકંદરે બોલીને સહાયતા કરવામાં, શહેર આ પ્રક્રિયામાં સક્રિયપણે પ્રવૃત્તમય રહ્યું છે, અને આગામી વર્ષોમાં પણ ભંડોળ નિર્ણયો કરવામાં આવે ત્યારે પ્રવૃત્તમય બની રહેશે.

નવી સંસ્થાપિત નેક્સ્ટ જનરેશન મેન્યુફેક્ચરિંગ કેનેડા (NGM Canada), ઉદ્યોગ અને સંઘીય સરકાર દ્વારા દરખાસ્ત હેઠળના રોકાણોમાં \$800M ઉપરાંત છુટા કરવામાં આગેવાન બની રહેશે, છેવટે ભંડોળ દરખાસ્તો અને પ્રોજેક્ટ્સથી ફર્મ્સ (પેઢીઓ), સપ્લાય ચેઈન (પુરવઠો પૂરો પાડનારાઓ), અને ચાવીરૂપ ઉદ્યોગ ક્ષેત્રમાં નિયુક્ત હજારો કેનેડિયન નાગરિકો માટે નવી તકો ઊભી થશે.

સુપર-ક્લસ્ટર ભૌગોલિક દૃષ્ટિએ ગ્રેટર ટોરોન્ટો હેમિલ્ટન વિસ્તાર પર ધ્યાન આપે છે, અને બ્રામ્પટન આર્થિક વિકાસ અને રોકાણ માટે નવી તકો રળવા તૈયાર થયું છે. શહેર આધુનિક ઉત્પાદન, સક્રિય ધંધાકીય ભાગીદારોમાં નોંધપાત્ર ઉપસ્થિતિ ધરાવે છે, અને શેરિડેન કૉલેજ અને રાયરસન યુનિવર્સિટી જેવા ગૌણ-પછીના (પોસ્ટ-સેકન્ડરી) ભાગીદારો સાથે પ્રવૃત્તમય છે. ઉત્પાદન ક્ષેત્ર બ્રામ્પટનમાં 35,000 થી વધારે નોકરીઓ, આશરે 900 કંપનીઓ મારફતે પૂરી પાડે છે. બ્રામ્પટનમાં પાંચમાંથી એક વ્યક્તિ ઉત્પાદન ક્ષેત્રમાં કામ કરે છે, અને શેરિડેનનું સેન્ટર ફોર એડવાન્સ મેન્યુફેક્ચરિંગ એન્ડ ડિઝાઈન ટેકનોલોજી અને શેરિડેનનું સ્કેલ ટ્રેડ્સ સેન્ટર જેવા ભાગીદારો આ ક્ષેત્રમાં તાકાત અને વિકાસ પૂરો પાડે છે.

આધુનિક ઉત્પાદન કેનેડાના આર્થિક વિકાસ માટે નિર્ણાયક ચાલકબળ છે. દક્ષિણ-પશ્ચિમી ઓન્ટેરિયો ઉત્પાદન અને ટેકનોલોજી, એમ બંને ક્ષેત્રમાં ધનિષ્ઠ ગીચતા ધરાવે છે.

એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સુપર-ક્લસ્ટર વ્યૂહરચના સાથે ત્રણ પાયાઓ જોડાયેલા છે:

- સહયોગી રોકાણ કરો - સહયોગી, ઉદ્યોગ-આગેવાન પ્રોજેક્ટ્સમાં, જેમ કે વિઝન સિસ્ટમ્સ, AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ), IoT, ડેટા સિક્યુરિટી, રોબોટિક્સ, એડવાન્સ મટિરીયલ્સ, અને એડિટિવ મેન્યુફેક્ચરિંગ
- સહાયતા કરો - નવા સાધનો, ટેસ્ટ-બેડ્સ અને માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં, જેથી અત્યાધુનિક ઉત્પાદન કંપનીઓ ઊભી કરવામાં મદદ મળી રહે
- નિર્માણ કરો - સહાયતા અને સેવાઓના ખડતલ પર્યાવરણતંત્રને, જે ઉત્પાદનમાં ટેકનોલોજી સ્વીકારણને વેગમય બનાવે, એટલે કે ટેકનોલોજી તૈયાર કરતા મૂલ્યાંકનો, તાલીમ અને આવડત વિકાસ, અને બજાર સહાયતા.

અવતરણો (ક્વૉટ્સ):

“હું ટોડ લેટ્સ (Todd Letts) અને બ્રામ્પટનના ટ્રેડ બોર્ડનો આભાર માનું છું જેઓએ એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સુપર-ક્લસ્ટરમાં બ્રામ્પટનના પ્રયત્નોને અગ્રગામી બનાવ્યા. આપણાં શહેરના સુદૃઢ ઉત્પાદન અને નવીન શોધના પાયાને સમર્થન આપવાનું તેઓનું દૂરદેશીપણું એ છે જેને અમે વહેંચીએ છીએ અને અમે આ બોલી જીતવા મદદરૂપ થવામાં તેઓએ કરેલી સખત વકાલત બદલ તેઓ સૌની કદર કરીએ છીએ. આ આપણું શહેર, સ્થાનિક ધંધાઓ, અને ગૌણ-પછીની સંસ્થાઓ માટે નવી ટેકનોલોજી, આર એન્ડ ડી, અને નવા કામદારોની તાલીમમાં રોકાણ કરવાની અજોડ તક દર્શાવે છે.”

- મેયર લિન્ડા જેફ્રી (Linda Jeffrey)

“આ ઘોષણા બ્રામ્પટનની તાકાતમાં સીધેસીધો વધારો કરે છે. બ્રામ્પટનમાં આધુનિક ઉત્પાદન ક્ષેત્રની પરિસ્થિતિ, અને આપણાં ગૌણ-પછીના ભાગીદારોની ક્ષમતાઓ નોકરીઓ અને રોકાણ માટેની શક્યતાઓ સુધારે છે જે આ નવા ભંડોળથી આવશે.”

- સીટી કાઉન્સિલર જેફ બોમેન (Jeff Bowman), પ્રમુખ, ઈકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ કલ્ચર (આર્થિક વિકાસ અને સંસ્કૃતિ)

“આધુનિક ઉત્પાદન એ આપણાં આર્થિક વિકાસના પ્રયત્નો માટે ચાવીરૂપ વિકાસ ક્ષેત્ર છે. આ પ્રદેશ માટે નવું ભંડોળ, અને બ્રામ્પટનલક્ષી દરખાસ્ત માટેની શક્યતાથી માત્ર તકો અને રોકાણ એવા વિસ્તારમાં વધારવામાં મદદ મળી શકે છે જે આપણાં રહેવાસીઓ માટે ઘણી બધી ઊંચી આવક આપતી, કુશળ નોકરીઓની પહોંચ પૂરી પાડે.”

- બોબ ડાર્લિંગ (Bob Darling), ડાયરેક્ટર ઈકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ કલ્ચર

-30-

બ્રામ્પટનમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાં છે. આપણે વેધક ધ્યાન કેન્દ્રિત કરતા ભવિષ્ય માટે તૈયાર સંસ્થા છીએ. આપણે આપણાં સમુદાયની વૃદ્ધિ જાણીએ છીએ, જુવાની અને વિવિધતા આપણને અલગ અલગ કરે છે. આપણે કેનેડાના નવીન શોધ કરતા સુપર કોરિડોરના કેન્દ્રમાં સ્થિત, રોકાણ પ્રોત્સાહક અને આપણી વૈશ્વિક સફળતા વિકસાવનાર છીએ. આપણે કંપાયમાન શહેરી કેન્દ્રો વિકસાવીએ છીએ જે તક પ્રજ્વલિત કરે છે અને અહીં રહેતા અને કાર્યરત લોકોમાં ગૌરવ રેડીએ છીએ. આપણે બ્રામ્પટનને આગળ વધારી રહ્યાં છીએ જે તેને નવીનતમ, સર્વગ્રાહી અને જુરસામય શહેર બનાવે. અમને [Twitter](#) અને [Facebook](#) પર અનુસરો. www.brampton.ca પર વધુ માહિતી જાણો.

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા કોર્ડિનેટર (Media Coordinator)

સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)

905.874.3654 | natalie.stogdill@brampton.ca